

આ પ્રકરણમાં તમે શું શીખશો ?

- પ્રસ્તાવના
- 2.1 સંચાલનના સિદ્ધાંતો
 - 2.1.1 અર્થ
 - 2.1.2 ઘ્યાલ
 - 2.1.3 સ્વરૂપ
 - 2.1.4 મહત્વ
- 2.2 સંચાલનની વિચારધારાઓ
 - 2.2.1 પ્રશિષ્ટ વિચારધારાઓ
 - 2.2.2 નવપ્રશિષ્ટ વિચારધારાઓ
 - 2.2.2.1 વર્તન સંબંધિત વિચારધારાઓ
 - 2.2.2.3 આધુનિક વિચારધારાઓ
- 2.3 ફેડરીક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત
 - 2.3.1 અર્થ
 - 2.3.2 વ્યાખ્યા
 - 2.3.3 વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો
 - 2.3.4 વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ
 - 2.3.4.1 સમય નિરીક્ષણ
 - 2.3.4.2 ગતિ નિરીક્ષણ
 - 2.3.4.3 ભિન્ન વેતન દરની પદ્ધતિ
- 2.4 હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો
- 2.5 પીટર એફ. ડ્રકરનું સંચાલન ક્ષત્રે પ્રદાન

પ્રસ્તાવના (Introduction)

સંચાલન એ સદીઓથી ચાલી આવતી પ્રવૃત્તિ છે. ઈતિહાસ પર નજર કરતાં દુનિયાના તમામ દેશોની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સંચાલનનાં તત્ત્વો જોવા મળે છે. ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં રાજ્ય વ્યવસ્થામાં અને છતપતિ શિવાજિ મહારાજાના સમયમાં યુદ્ધ રણનીતિની વ્યૂહરચનામાં સંચાલનનો સારી રીતે ઉપયોગ થયેલો જોવા મળે છે. અનેક સંચાલન શાસ્ત્રીઓ, ચિંતકો, વિચારકો અને લેખકોએ સમય-સમય પર સંચાલનની અવધારણાનું મૂલ્યાંકન અને પુનઃવિચારણા કરી નવા-નવા સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. આમ, સંચાલનના ઘ્યાલનો ઈતિહાસ ખૂબ જ પ્રાચીન છે અને સમયાંતરે બદલાતો રહ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સંચાલન વિચારધારાઓ જુદા-જુદા અભિગમ સ્વરૂપે રજૂ થતી રહી છે. ફેડરીક ટેલરથી લઈ હેનરી ફેયોલ, ગીલબ્રેથ, મેક્સ વેબર, ચેસ્ટર બર્નાર્ડ, પીટર એફ. ડ્રકર અને સી. કે. પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓએ વિવિધ સિદ્ધાંતોના પ્રતિપાદન દ્વારા સંચાલનના સિદ્ધાંતોને યુગાનુકૂળ કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. હેરોલ્ડ કુન્તાજે તો સંચાલન વિચારધારાઓને ‘જંગલ’ તરીકે ઓળખાવી છે.

2.1 સંચાલનના સિદ્ધાંતો (Principles of Management)

2.1.1 અર્થ (Meaning) : સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકો માટે માર્ગદર્શક ભૂમિકા ભજવે છે. હકીકતમાં સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી, માત્ર ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો નિયોગ છે. જુદા-જુદા સંચાલન શાસ્ત્રીઓએ જુદી-જુદી પરિસ્થિતિમાં

મેળવેલ તારણો છે અને તે વ્યવહારું સાબિત થયાં છે. તેના અમલીકરણથી સચોટ પરિણામો પડા પ્રાપ્ત થયાં છે, તેથી આ સિદ્ધાંતો ધંધાકીય એકમ માટે સંચાલન પ્રણાલીનો ભાગ બની જાય છે.

ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો, સિદ્ધાંતો ઘડવા પડે છે; જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને. આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે.

2.1.2 ઘ્યાલ (Concept) : સંચાલન એ કલા અને વિજ્ઞાનનો સમન્વય છે. વિજ્ઞાન હોવાથી તેમાં સિદ્ધાંતો હોય તે સ્વાભાવિક છે. શુદ્ધ વિજ્ઞાનની માફક સંચાલનના સિદ્ધાંતો જરૂર નથી, પરંતુ પરિવર્તનશીલ છે. સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે, તેથી જ સમયાંતરે તેમાં જરૂરી ફેરફારો કરી નવા સિદ્ધાંતોના ઉમેરાને અવકાશ રહે છે. માનવ વર્તણૂક અને ટેકનોલોજી એવાં પરિબળો છે કે જે સમયાંતરે બદલાતાં રહે છે. આ પરિવર્તનોને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફાર થતો રહે છે.

સંચાલનના સિદ્ધાંતો એ નિર્ણય ઘડતર અને તેના અમલીકરણ માટેની વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા છે. સંચાલનના સિદ્ધાંત અનુસાર વિવિધ પ્રોત્સાહનો દ્વારા કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. દા. ત. કોઈ એક

કર્મચારીની બદતી અંગેના નિર્ણય માટે તેની નોકરીનાં વર્ષને આધારભૂત ગણવામાં આવે, જ્યારે અન્ય એકમમાં કર્મચારીની કાર્યદક્ષતાને ધ્યાન લઈ બદતી આપવામાં આવે.

સંચાલનના સિદ્ધાંતો તથા સંચાલનની પ્રયુક્તિઓ વચ્ચેનો બેદ સમજવો અત્યંત જરૂરી છે. પ્રયુક્તિઓ કે રીતો (Methods and Techniques) એ ધ્યાસિદ્ધિ માટે લેવામાં આવેલાં વિવિધ પગલાં ઓનો સમૂહ છે; જ્યારે સિદ્ધાંતો એ પ્રયુક્તિઓના અમલ વખતે લેવામાં આવેલા નિર્ણયો અંગેની માર્ગદર્શિકા છે. પ્રયુક્તિઓની જેમ જ સિદ્ધાંતો અને મૂલ્યો વચ્ચેનો બેદ સમજવો પણ અત્યંત જરૂરી છે. મૂલ્યો એ સ્વીકાર્ય અથવા ઈચ્છાનીય હોય છે, તે નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે; જ્યારે સિદ્ધાંતો એ માનવ વર્તણૂક માટેનું સર્વ સામાન્ય સત્ય તથા માર્ગદર્શિકા છે.

2.1.3 સ્વરૂપ (Nature) : સંચાલનના સિદ્ધાંતો વ્યવહારું તારણ છે, ૪૩ નથી. આ સિદ્ધાંતો કાર્ય કરવા માટેની માર્ગદર્શિકા છે. જે કાર્ય અને કારણાનો સંબંધ ધરાવે છે. સંચાલનનાં જુદાં-જુદાં કાર્યો જેવાં કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશની અમલવારી વખતે સંચાલનના સિદ્ધાંતો સંચાલકને નિર્ણય ઘડતર માટે માગદર્શક ભૂમિકા પૂરી પાડે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ સિદ્ધાંતો એ મોટે ભાગે સત્ય હોય છે, પરંતુ સંપૂર્ણ સત્ય નથી. તેમાં પણ અપવાદનો નિયમ રહે છે. સંચાલનના સિદ્ધાંતોની ઉપર્યુક્ત ચર્ચા પરથી તેના સ્વરૂપ અંગે નીચે મુજબના મુદ્દાઓ તારવી શકાય :

(1) સાર્વત્રિક સ્વીકૃતિ : સંચાલનના સિદ્ધાંતો મોટા ભાગનાં ધંધાકીય એકમોને લાગુ પાડી શકાય છે. જ્યાં જ્યાં સામૂહિક માનવીય પ્રયત્નોની જરૂરિયાત છે, ત્યાં આ સિદ્ધાંતોની આવશ્યકતા રહે છે. જોકે ધંધાકીય એકમના પ્રકાર, સ્વરૂપ, પ્રવૃત્તિ અને કદ મુજબ સંચાલનના બધા સિદ્ધાંતો લાગુ પાડવાની માત્રામાં ફેરફાર હોય છે, પરંતુ મોટા ભાગનાં ધંધાકીય એકમોમાં સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે. તેથી સંચાલનના સિદ્ધાંતો સર્વબ્યાપક કે સાર્વત્રિક છે.

(2) પરિવર્તનશીલ : સંચાલનના સિદ્ધાંતો એ જરૂર તારણ નથી, પરંતુ પરિવર્તનશીલ છે. સંચાલકને જ્યારે અને જેવી પરિસ્થિતિમાં જરૂર જણાય ત્યાં તેમાં પરિવર્તનશીલતાને અવકાશ છે. કેટલીક પરિસ્થિતિમાં આ સિદ્ધાંતો બંધબેસતા ન જણાય ત્યારે સંચાલકને તેમાં ફેરફાર કરવાની છૂટ રહે છે. દા. ત. કાર્ય વિભાજનનો સિદ્ધાંત મોટા એકમોમાં એકસમાન રીતે લાગુ કરી શકાય, પરંતુ નાનાં એકમોમાં તેટલી જ માત્રામાં કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ કરી શકાતો નથી.

(3) સામાન્ય માર્ગદર્શિકા : સંચાલનના સિદ્ધાંતો એ જુદી-જુદી પરિસ્થિતિમાંથી જુદા-જુદા નિષ્ણાતો દ્વારા થયેલા અનુભવોની ફલશુદ્ધિ છે. ધંધાકીય એકમનું સંચાલન કરતી વખતે એકમમાં વિષમ અને જટિલ સમસ્યાઓ આવતી હોય છે. આ દરેક સમસ્યાનું સ્વરૂપ એકમ અનુસાર જુદું-જુદું હોય છે, જે દરેક પરિસ્થિતિમાં દરેક એકમ માટે એક સરખું પરિણામ આપી શકે નહિ. તેથી સંચાલનના સિદ્ધાંતોને દરેક એકમ માટે ચુસ્ત રીતે લાગુ પાડી શકાય નહિ, પરંતુ સિદ્ધાંતોનો માત્ર એક માર્ગદર્શિકા તરફે, સાનુકૂળ પરિસ્થિતિમાં ઉપયોગ કરી, ઈચ્છિત પરિણામો મેળવી શકાય છે.

(4) માનવ વર્તણૂક પર આધારિત : સંચાલનમાં માનવ કેન્દ્રસ્થાને હોવાથી સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તણૂક ઉપર મોટી અસર જન્માવે છે. સંચાલનના સિદ્ધાંતોને માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ રહેલો છે અને માનવ વર્તણૂક એ મનોવૈજ્ઞાનિક બાબત છે, જે સંચાલનના સિદ્ધાંતોના અમલ વખતે ધ્યાનમાં લેવી જરૂરી છે.

(5) આક્સિમિકતા : સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવા માટેનું એક તત્ત્વ આક્સિમિકતા પણ છે. કોઈ એક ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં આ સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણયો લઈ, ધ્યેય સિદ્ધિ સરળ બનાવી શકે છે. જેમ કે, કર્મચારીઓને યોગ્ય અને વાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ. શું આ યોગ્ય અને વાજબી છે ? તે આક્સિમિકતા કે જરૂરિયાતને આધારે અસરકરતા પરિબળોને ધ્યાને લઈ નક્કી કરી શકાય.

2.1.4 મહત્વ (Importance) : સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકીય વર્તણૂકને દીર્ઘદિશા પૂરી પાડે છે તેમજ સંચાલન કાર્યને ખૂબ જ પ્રભાવિત કરે છે. સંચાલકો ધ્યેય સિદ્ધિ માટે તેનો ઉપયોગ કરે છે. આ સિદ્ધાંતો સંચાલકોને નિર્ણય ઘડતર માટે દિશાસૂચન કરે છે. આમ, સંચાલનના સિદ્ધાંતો એ કોઈ પણ એકમ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. તેનું મહત્વ નીચે મુજબ વર્ણવી શકાય :

(1) સંચાલકીય કાર્યક્રમતામાં વધારો : સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે

કાર્ય કરવું તે માટે માર્ગદર્શન પૂરું પાડે છે. જેના દ્વારા ધંધાકીય એકમની કાર્ય પદ્ધતિમાં સુધારો આવે છે અને તેનાથી સંચાલકીય કાર્યક્રમતામાં પણ વધારો થતો જોવા મળે છે.

(2) સંસાધનોનો ઈષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ : ધંધાકીય એકમમાં પ્રાપ્ત થતા માનવ અને ભौતિક સંસાધનો માટે ભાગે મર્યાદિત હોય છે. તેનો ઈષ્ટતમ ઉપયોગ કરવો અનિવાર્ય છે. ઈષ્ટતમનો અર્થ એવો થાય છે કે સંસાધનોનો સંચાલનના સિદ્ધાંતો દ્વારા એવી રીતે ઉપયોગ કરવો કે જેથી ઓછામાં ઓછા ખર્ચ વધુમાં વધુ લાભ મેળવી શકાય. સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને તેમના દ્વારા લેવામાં આવેલ નિર્ણયો; કાર્યોનું કારણ અને અસર જોવા માટેની તક આપે છે, જેનાથી પ્રયત્ન અને ભૂલ દ્વારા થતો બગાડ અટકાવી શકાય છે.

(3) વૈજ્ઞાનિક અને ટાઇકિ નિર્ણયો માટે મદદરૂપ : નિર્ણયો હંમેશાં હકીકત આધારિત, વૈચારિક રીતે લેવાયેલા; હેતુને સુસંગત અને ન્યાયી હોવા જોઈએ. તે ઉપરાંત નિર્ણયો સમયસર, વાસ્તવિકતા પૂર્ણ અને અસરકારક હોવા જોઈએ. સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને યોગ્ય નિર્ણય લેવા માટે ચાવીરૂપ ભૂમિકા પુરી પાડે છે. સંચાલનના સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા પક્ષપાત અને પૂર્વગ્રહ વગરના યોગ્ય નિર્ણયો સમયસર લઈ શકાય છે.

(4) બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા : સામાન્ય રીતે તો સંચાલનના સિદ્ધાંતો એ સામાન્ય માર્ગદર્શિકા જ છે, પરંતુ બદલાતી જતી પરિસ્થિતિમાં બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોની જરૂરિયાત રહે છે.

(5) સામાજિક જવાબદારી અદા કરવા : ધંધો એ સમાજનું અવિભાજ્ય અંગ છે. નફાને ધંધાનો એક ધ્યેય ગણવામાં આવે છે, પરંતુ એકમાત્ર ધ્યેય નથી. સમાજનો વિકાસ અને ઉન્નતિ એ પણ ધંધાકીય એકમના ધ્યેય છે. સંચાલનના સિદ્ધાંતોનાં અસરકારક અમલ દ્વારા ધંધાકીય એકમ સરળતાથી સામાજિક જવાબદારીનું લક્ષ્ય સિદ્ધ કરી શકે છે.

(6) સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી : સંચાલનના સિદ્ધાંતો એ સંચાલન વિચારધારાનો મુખ્ય ભાગ છે. સંચાલનના સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા જ તાલીમ, શિક્ષણ અને વિકાસનું કાર્ય શક્ય બને છે. જેમ કે, હવે વિવિધ ધંધાકીય એકમોમાં નિમણુંક માટે અભિરૂચિ કસોટી લેવામાં આવે છે. આ અભિરૂચિ કસોટી એ સંશોધનથી તૈયાર કરવામાં આવેલ હોય છે અને સંચાલનના સિદ્ધાંતોના અમલ દ્વારા તેનો ઉપયોગ કરી યોગ્ય કર્મચારીની નિમણુંક કરવામાં આવે છે.

2.2 સંચાલનની વિચારધારાઓ (Thoughts of Management)

સંચાલન ક્ષેત્રે થયેલાં વિવિધ સંશોધનો, અભ્યાસો અને પરિણામોને આધારે સંચાલનની વિચારધારાઓનો વિકાસ થયો છે. સમય અનુસાર દરેક વિચારધારાઓ તેના વિશિષ્ટ દસ્તિબંદુની રજુઆત છે. આ વિચારધારાઓમાં પણ અનેક સંચાલન શાસ્ત્રીઓએ અલગ-અલગ મત આપી, જુદા-જુદા સિદ્ધાંતો આપ્યા છે. તેથી તેમાં પણ અનેક શાખા-પ્રશાખાઓનો વિકાસ થયો છે. તેને સંચાલનની વિચારધારાઓ અથવા અભિગમો પણ કહેવામાં આવે છે. સંચાલનની કેટલીક વિચારધારાઓ નીચે મુજબ છે :

2.2.1 પ્રશિષ્ટ વિચારધારાઓ (Thoughts of Classical Theory) : સંચાલનની વિચારધારાઓમાં 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તે વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા સંચાલનશાસ્ત્રીઓ ફેડરિક ટેલર, મેક્સ વેબર, ગીલબર્થ, હેનરી ગેન્ટ અને હેનરી ફેયોલ છે. પ્રશિષ્ટ વિચારધારામાં ટેલરનો ફાળો ખૂબ જ મહત્વનો છે. ફેડરિક ટેલરે આપેલ વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ રૂઢિગત પદ્ધતિઓને બદલે સમય અને ગતિના નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતોને અપનાવવાની તરફેણ કરે છે. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતનું મુખ્ય પ્રદાન વ્યવસ્થાતંત્રમાં વિશિષ્ટીકરણ, ઉત્તેજક વેતનપ્રથા, જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી બાબતે રહેલું છે. પ્રશિષ્ટ વિચારધારામાં હેનરી ફેયોલનું પ્રદાન પણ નોંધપાત્ર રહ્યું છે. તેમણે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપી સંચાલન વિચારધારામાં મહત્વનું યોગદાન આપ્યું. તેમણે ધંધાકીય એકમમાં વિવિધ કાર્યોની સપાટી નક્કી કરી; કાર્યોની મર્યાદા નક્કી કરવાનો પ્રયત્ન કર્યો. જુદા-જુદા સ્તરે સંચાલકીય ફરજો બજાવવા માટે સંચાલનના સાર્વત્રિક સિદ્ધાંતો માર્ગદર્શિકારૂપે આપ્યા. આ સિવાય પ્રશિષ્ટ વિચારધારામાં મેક્સ વેબરના અમલદારશાહીના વિચારનું પણ પ્રદાન રહેલું છે. ઓગણીસમી સદીના અંત સુધી ઔદ્યોગિક કાંતિને પરિણામે ધંધાકીય એકમોનું સ્વરૂપ અને કદ બદલાવા લાગ્યા. પરિણામે પ્રશિષ્ટ વિચારધારાની

કેટલીક મર્યાદાઓને લીધે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થઈ. તેની મર્યાદાઓમાં મુખ્યત્વે નાણાંકીય ઉતોજનને વધુ સ્થાન, માનવીય અભિગમને ઓછું મહત્વ તથા અવૈધિક સંબંધોની અવગણાના મુખ્ય છે.

2.2.2 નવપ્રશિષ્ટ સંચાલનની વિચારધારાઓ (Thoughts of Neo-Classical Theory) : સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક ખામીઓને દૂર કરવા માટે કેટલાંક સંચાલન શાસ્ત્રીઓએ તેમાં સુધારા કરી નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા, જેને નવપ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. ઓગણીસમી સદીના અંત ભાગમાં ઔદ્યોગિક કાંતિ પછી એકમો/ઉદ્યોગોનું સ્વરૂપ બદલાયું અને નવી સંચાલન તરેહની જરૂરિયાત ઊભી થઈ. વીસમી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોના હોર્થોન પ્રયોગોએ આ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો. તેથી એલ્ટન મેયોને નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણોતા કહે છે. નવપ્રશિષ્ટ વિચારધારા સંચાલન અંગે વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂકે છે. પ્રશિષ્ટ વિચારધારાઓને જ આધારરૂપે રાખી નવપ્રશિષ્ટ વિચારધારામાં અવૈધિક વ્યવસ્થાતંત્ર, માનવ વર્તન, માનવ સંબંધો, પ્રેરણા વગેરે તત્ત્વોનો ઉમેરો થયો. આ વિચારધારામાં મુખ્યત્વે એલ્ટન મેયો, રેન્સીસ લિકર્ટ, હર્ઝબર્ગ, કીસ આર્ગિરિસ, મેકગ્રેગર અને માસ્લો મુખ્ય યોગદાનકર્તાઓ છે. નવપ્રશિષ્ટ સંચાલન વિચારધારાની મુખ્ય પ્રશાખાઓમાં માનવ સંબંધો કે માનવવર્તનવાદી વિચારધારા, સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારા મુખ્ય છે, જેમાં માનવવર્તનવાદી વિચારધારા નીચે મુજબ છે :

2.2.2.1 વર્તન સંબંધિત વિચારધારા (Thoughts of Behaviour Related) : સંચાલન એ અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કણા છે. જેમ પ્રો. ઉર્વિકે કહ્યું છે, ‘તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશો’ તેમ કર્મચારી કે વ્યક્તિ એ એકમમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. સંચાલન વ્યક્તિ મારફતે થતું હોવાથી સંચાલનનો અભ્યાસ આંતરવ્યક્તિ સંબંધોનો અભ્યાસ બની રહે છે. સંચાલકીય કાર્યનું અગત્યનું કેન્દ્રબિંદુ માનવ વર્તન અને માનવ સંબંધોનું છે તેથી વર્તન સંબંધિત વિચારધારા, મનોવૈજ્ઞાનિક તારણોના ઉપયોગ દ્વારા કર્મચારીના કાર્યસંતોષ અને કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકે છે. વર્તન સંબંધિત વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતીસંચાર પ્રક્રિયા, ઔદ્યોગિક ઝગડાઓના નિકાલ વગેરે જેવા ખ્યાલોનો સમાવેશ થાય છે. આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળની ક્યાંક અવગણાના થઈ હોય તેવું જણાય છે. ઉત્પાદકતાને ભોગે માનવસંબંધોની જાળવણી થઈ શકે નહિ તેવું કેટલાંક લેખકોનું તાર્કિક વિધાન છે, જે આ અભિગમની મુખ્ય મર્યાદા છે.

2.2.3 આધુનિક વિચારધારાઓ (Thoughts of Modern Management) : ઈ. સ. 1960 પછી ઉદ્યોગો અને ધ્યાકીય એકમોના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું. પરિણામ સ્વરૂપે સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ. સંચાલન માત્ર એક ધ્યાકીય એકમનું ક્ષેત્ર ન રહેતાં સંચાલકોનો વિશિષ્ટ વ્યાવસાયિક વર્ગ આ સમય દરમિયાન ઊભો થયો. સંચાલનની સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર ગણિતશાસ્ત્ર અને કમ્પ્યુટર ઇન્ફર્મેશન ટેકનોલોજીના ઉપયોગની પણ આ વિચારધારામાં હિમાયત કરવામાં આવી છે. આ વિચારધારામાં કુન્તાજ, ઓડેનલ, જ્યોર્જ આર. ટેરી જેવા સંચાલન શાસ્ત્રીઓએ પોતાનું પ્રદાન આવ્યું છે. આ ઉપરાંત પીટર એફ. ડ્રકર, વિલિયમ ઓચી અને સી. કે. પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓએ પણ આ વિચારધારામાં ફાળો આપ્યો છે.

2.3 ફેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત (Frederick Winslow Taylor's Principle of Scientific Management)

પ્રશિષ્ટ વિચારધારામાં મહત્વનું યોગદાન આપનાર ફેડરિક વિન્સલો ટેલર અમેરિકન મિકેનિકલ ઇઝનેર હતા. શરૂઆતના તબક્કે તેઓ સામાન્ય કર્મચારી એપ્રેન્ટિસ તરીકે એક કારખાનામાં જોડાયા, ત્યારબાદ કમશા: એક પછી એક કંપનીમાં પ્રદાન આપી તેઓ બેથલહેમ સ્ટીલ કંપનીમાં મેનેજર બન્યા. એફ. ડબ્લ્યુ ટેલરે સૌ પ્રથમવાર આ દરમિયાન વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો, તેથી તેમને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે.

ધ્યાકીય સંચાલનમાં સામાન્ય રીતે બે વર્ગો ખૂબ મહત્વના છે. માલિકો અટેલે કે સંચાલકોનો મુખ્ય હેતુ નફા અને સંપત્તિના મહત્વમિકરણનો હોય છે, જ્યારે કર્મચારીઓને વધુ વેતન, કાર્યસંતોષમાં રસ હોય છે. આને પરિણામે બને જૂથો વચ્ચે ધ્યેયોની એકસૂત્રતા જાળવવામાં સંવર્ષ થતો જોવા મળે છે. આ બાબતે ફેડરિક ટેલરે રૂઢિગત પદ્ધતિને પડકારી, નવી પદ્ધતિને વિકસાવવાનું શરૂ કર્યું. રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા. જેને હુકમનો નિયમ (Rule of Thumb) કહે છે. મજૂરોનો કોઈ સ્વતંત્ર અવાજ ન હતો.

માલિકોની જોડુકમી અને વર્ચેસ્વ ખૂબ જ વધી ગયાં હતાં. આ સમયે હુકમના નિયમને બદલે ટેલરે વૈજ્ઞાનિક દાખિકોણ સાથે નવો જ્યાલ રજૂ કર્યો, જેને વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખાવાય છે.

2.3.1 અર્થ (Meaning) : વૈજ્ઞાનિક સંચાલન કોઈપણ ખાસ એકમમાં કે કારખાનામાં, કર્મચારીઓના પક્ષે સંપૂર્ણ માનસિક કાંતિ છે. તેઓની તેમના કાર્ય, ફરજો, સહકાર્યકર્તાઓ અને માલિકો પ્રત્યેની સંપૂર્ણ માનસિક કાંતિ છે.

2.3.2 વ્યાખ્યા (Definition) : વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા આપતાં ફેરફાર ટેલર જણાવે છે કે, ‘તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે તથા ઓછામાં ઓછા ખર્ચ કામ કરે તે જોવું એટલે વૈજ્ઞાનિક સંચાલન.’

ફેરફાર ટેલર પોતે પણ એક એન્જિનીયર હોવાને લીધે તેમના અભ્યાસને આધારે તેમણે તારવ્યું કે જ્યાં સુધી કામદારોને ઊંચા અને ઉત્તેજક વેતનદર નહિ મળે ત્યાં સુધી તેઓ કાર્યદક્ષતાથી કામ નહિ કરે. કામદારો પાસે માત્ર રૂઢિગત મજૂરી કરાવ્યા વગર ઊંચી ઉત્પાદકતાની પ્રાપ્તિ માટે વૈજ્ઞાનિક રીતોનો ઉપયોગ કરી નીચો ઉત્પાદન ખર્ચ મેળવવો જોઈએ. આ માટે સંચાલકોએ વેતનદર ઘટાડવા ન પડે અને કર્મચારીઓએ કામચોરી કરવી ન પડે એ પ્રકારની પદ્ધતિ અપનાવવાનો વૈજ્ઞાનિક અભિગમ સૂચ્યવ્યો હતો. રૂઢિગત સંચાલનના પડકાર સ્વરૂપે તેમણે એક કાંતિકારી વિચાર રૂપે વૈજ્ઞાનિક સંચાલનને રજૂ કર્યું, જેમાં મુખ્યત્વે નીચેની બાબતો જોવા મળે છે.

- (1) દરેકે કામદારને તેની બુદ્ધિ અને શક્તિ અનુસાર કામની સૌંપણી કરવી જોઈએ.
- (2) કક્ષા અનુસાર મહત્તમ કામ કરવા માટે દરેક કામદારને સૂચના આપવી જોઈએ.
- (3) ઝડપથી કાર્યદક્ષ રીતે કામ કરનાર દરેક કામદારને તેની કક્ષાના વેતન કરતાં 30 ટકાથી 100 ટકાના દરે વધુ વેતન આપવું જોઈએ.

2.3.3 વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો (Principle of Scientific Management) : ફેરફાર ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ એક કાંતિકારી પગલું હતું. તેઓ રૂઢિગત ચીલાચાલું પદ્ધતિથી દૂર હતા. કામદારો અને માલિકો એકસૂત્રતાથી કામ કરે તે હેતુસર તેમણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપ્યા જે નીચે મુજબ છે :

- (1) **વૈજ્ઞાનિક પદ્ધતિ :** કાર્ય કરવા રૂઢિગત પદ્ધતિઓના ઉપયોગનો ત્યાગ કરી નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ અને કાર્યનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરી શેષ કાર્ય કેવી રીતે થાય તેનો વિચાર કરવો જોઈએ.
- (2) **આયોજન અને અમલીકરણ :** રૂઢિગત પદ્ધતિની જેમ કામદારો જ આયોજન અને અમલીકરણ કરે તેના બદલે આયોજનનું કામ નિર્ણાતો કરે અને કામદારો તેનું અમલીકરણ કરે તેમ હોવું જોઈએ.
- (3) **કાર્ય-વિશ્લેષણ :** ઓછો ખર્ચ અને ઝડપી કામ કરવા માટે કાર્ય વિશ્લેષણ ઉત્તમ છે. જેમાં સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણનો અભ્યાસ કરી ઓછી પડતરે ઉત્પાદકતામાં વધારો કરી શકાય.
- (4) **પ્રમાણીકરણ :** પ્રમાણીકરણ અને સરળીકરણ એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જે અગાઉથી થવી જોઈએ. ઓજારો, સાધનો, સમય, કામકાજની સ્થિતિ વગરે બાબતો માટે પ્રમાણીકરણ જરૂરી બને છે.
- (5) **વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ :** કામદારોની પસંદગી યોગ્ય રીતે વૈજ્ઞાનિક ધોરણે થવી જોઈએ. વૈજ્ઞાનિક ધોરણ માટે કર્મચારીઓના શિક્ષણ, કૌશલ્ય, આવદત, શારીરિક શક્તિ, તાલીમ વગરેને માપદંડ તરીકે ધ્યાનમાં લઈ શકાય. આ ઉપરાંત કર્મચારીને એવા પ્રકારની કામગીરી સૌંપવી જોઈએ કે; જે તેના શિક્ષણ, અભ્યાસ અને કૌશલ્યને અનુરૂપ હોય. સમયાંતરે કામદારોની કાર્યક્ષમતા વધારવા તાલીમનો ઉપયોગ પણ થવો જોઈએ. વળી, તેમની કાર્યરૂચિ જાણવા વિવિધ પ્રકારની વૈજ્ઞાનિક કસોટીનો ઉપયોગ થવો જોઈએ.
- (6) **નાણાંકીય ઉત્તેજન :** કુશળ કામદારોને નાણાંકીય અને અન્ય પ્રકારનાં ઉત્તેજન આપવાં જોઈએ. આ માટે વિવિધ પ્રકારની ઉત્તેજક વેતન યોજનાની ભલામણ કરવામાં આવી છે. દરેક કામદારના વ્યક્તિગત ઉત્પાદનના આધારે આ પ્રથા અપનાવવી જોઈએ. તેમના વેતન દર ધારણાના આધારે નહિ, પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસથી નક્કી થવા જોઈએ.
- (7) **કરકસર :** વૈજ્ઞાનિક સંચાલનના અમલ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક અને ટેક્નિકલ આધારો જ ધ્યાનમાં ન લેવાતાં ઓછી પડતર પર ભાર મૂકવો જોઈએ. આ માટે પડતર અંદાજ અને પડતર અંકુશની પદ્ધતિઓ વિચારી અને વિચલનો શાંખી તેનો અભ્યાસ અને ઉકેલ આપવો જોઈએ.
- (8) **માનસિક કાંતિ :** માલિકો અને મજૂરો વચ્ચે ધ્યેયની સિદ્ધિ માટે માનસિક કાંતિ થવી જોઈએ. માનસિક સંવાદિતાથી માલિકો અને કામદારો વચ્ચે તનાવમાં ઘટાડો થાય છે અને ધ્યેયસિદ્ધિ સરળ બને છે.

2.3.4 વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ (Techniques of Principles of Scientific Management) :

2.3.4.1 સમય નિરીક્ષણ (Time Study) : કોઈ પડા કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે, તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. આ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે છે, તેને પ્રમાણસમય કહેવામાં આવે છે. ટેલરના મત અનુસાર જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ એ સમય નિરીક્ષણ છે. ઉત્પાદનના સાધનોનો ઈષ્ટતમ ઉપયોગ કરવાની દિશામાં તથા સમયસર લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે સમય નિરીક્ષણ ઉપયોગી છે.

2.3.4.2 ગતિ નિરીક્ષણ (Motion Study) : ગતિનિરીક્ષણ એટલે બિનજરરી ખોટી દિશામાં થતાં, બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ. કામદાર કાર્ય સમયે જે હલન-ચલન કરે છે તેનો જો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો હલન-ચલનની ખોટી પ્રક્રિયા દૂર કરી કામદારનો ઔદ્યોગિક થાક દૂર કરી શકાય છે, તેમજ ઉત્પાદકતામાં પણ વધારો કરી શકાય છે. ગતિ નિરીક્ષણનો મુખ્ય ઉપયોગ શ્રમના લઘૃતમ બગાડની પદ્ધતિ માટે યોજના શોધવાનો અને તેનો અમલ કરવાનો છે.

2.3.4.3 બિન્ન વેતનદરની પદ્ધતિ (Differential Wage Rate Study) : કામદારોને તેમના કામના સમયને આધારે વેતન સંબંધી ઉતેજન આપવાની પદ્ધતિ એટલે બિન્ન વેતનદરની પદ્ધતિ ઉત્પાદન વૃદ્ધિ માટે કામદારોને ઉતેજન આપવા માટે ટેલરે ઉતેજક વેતનપ્રથાની હિમાયત કરી હતી. કારખાનામાં કામ કરતા દરેક કામદારોની કાર્ય કરવાની ક્ષમતા અલગ-અલગ હોય છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને કાર્યક્ષમ કામદારોને વધુ ઉત્પાદનના સંદર્ભમાં વધુ વેતન મળવું જોઈએ અને ઓછી કાર્યક્ષમતાવાળા કામદારોને ઓછું વેતન મળવું જોઈએ. આ બાબત ધ્યાને રાખીને ટેલરે બિન્ન વેતન દરની પદ્ધતિ આપી છે.

2.4 હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો (Principles of Management by Henry Fayol)

સંચાલનના સિદ્ધાંતો રજૂ કરનાર હેનરી ફેયોલ એક ફેન્ચ એન્જિનીયર અને ઉદ્યોગપતિ હતા. ઈ. સ. 1916માં તેમણે પોતાના પુસ્તક 'ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન (Industrial and General Management)'માં આ સિદ્ધાંતોની રજૂઆત કરી,

હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓને સિદ્ધાંતોની સરળતા અને સ્પષ્ટતા માટે છ ભાગમાં વહેંચી હતી.

(1)	ટેકનિકલ પ્રવૃત્તિઓ	જેમાં કારખાના-યંત્રો તેમજ ઉત્પાદનને લગતી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
(2)	વાણિજ્ય પ્રવૃત્તિઓ	જેમાં એકમની ખરીદી, વેચાણ, વિનિમય જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
(3)	નાણાકીય પ્રવૃત્તિઓ	જેમાં મૂડીની પ્રાપ્તિ, મૂડીનો ઉપયોગ, ભંડોળની જાળવણી, પુનરોકાણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
(4)	સંરક્ષણ પ્રવૃત્તિઓ	જેમાં કર્મચારીઓની સલામતી, ભિલકતોની સલામતી, માલ-સામાનની સલામતી વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
(5)	હિસાબી પ્રવૃત્તિઓ	જેમાં નાણાકીય હિસાબોનાં પત્રકો, તેમજ જરૂરી આંકડાકીય માહિતી મેળવવાની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
(6)	સંચાલકીય પ્રવૃત્તિઓ	જેમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન, અંકુશ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

હેનરી ફેયોલે સંચાલનના સિદ્ધાંતો વિકસાવ્યા જે સંપૂર્ણપણે નવા હતા. તેમનું માનવું હતું કે કોઈપણ ઔદ્યોગિક એકમમાં સંચાલકે સફળ થવા માટે માત્ર જ્ઞાન જ મહત્વાનું નથી, પરંતુ જે-તે ઔદ્યોગિક એકમનાં સ્વરૂપને અનુરૂપ કામગીરીની પદ્ધતિથી વાકેફ હોવું જરૂરી છે. હેનરી ફેયોલે તેમના અનુભવ તેમજ જ્ઞાનને આધારે સંચાલનના ચૌદ્દ મહત્વના સિદ્ધાંતો રજૂ કર્યા હતા. જે સંચાલન ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે.

હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો નીચે પ્રમાણે છે :

- | | |
|---------------------------------------|---|
| (1) શ્રમ વિભાજનનો સિદ્ધાંત | (2) સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત |
| (3) શિસ્તનો સિદ્ધાંત | (4) હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત |
| (5) દોરવણીની એકવાક્યતાનો સિદ્ધાંત | (6) સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન |
| (7) કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત | (8) કેન્દ્રીકરણનો સિદ્ધાંત |
| (9) સત્તાની રૈભિક સંકળનો સિદ્ધાંત | (10) વ્યવસ્થાનો સિદ્ધાંત |
| (11) સમાનતાનો સિદ્ધાંત | (12) સ્થિર કર્મચારીગણનો સિદ્ધાંત |
| (13) પહેલવૃત્તિનો સિદ્ધાંત | (14) જુથ ભાવનાનો સિદ્ધાંત |

ઉપર્યુક્ત સિદ્ધાંતો રજૂ કરતાં શ્રી હેનરી ફેયોલ જણાવે છે કે, ‘આ માત્ર માર્ગદર્શક સિદ્ધાંતો જ છે. આ સિદ્ધાંતોની સફળતાનો આધાર સંચાલકોની કુશાગ્ર બુદ્ધિ પર રહેલો છે, તે એક શાશપણનું કામ છે.’ આ સિદ્ધાંતોની સમજૂતી નીચે મુજબ આપી શકાય :

(1) શ્રમ વિભાજનનો સિદ્ધાંત : સંચાલનમાં કર્મચારીઓ તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવે છે. ઉત્પાદનનાં સાધનોના ઈધ્રતમ ઉપયોગ દ્વારા ઉત્પાદકતા વધારી શકાય છે. આ ઉપરાંત કર્મચારી તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજન જરૂરી છે. શ્રમ વિભાજનને કારણે વિશિષ્ટીકરણ પણ શક્ય બને છે. શ્રમ વિભાજન સંચાલકોની કક્ષાએ તેમજ કારખાના કક્ષાએ એમ બંને કક્ષાએ થવું જરૂરી છે. તેનાથી વિશિષ્ટીકરણના સિદ્ધાંતનો લાભ લેવો જોઈએ.

(2) સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત : સત્તા અને જવાબદારી એ એક સિક્કાની બે બાજુઓ છે. જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને અધૂરાં છે. જ્યારે તાબેદારને કામ વિશેની કોઈ જવાબદારી સોંપવામાં આવે ત્યારે તે અંગેની સત્તા પણ સોંપવી જરૂરી છે. સત્તા સોંપણી વખતે કર્મચારીનો હોદ્દો, જ્ઞાન, લાયકાત, અનુભવ, નેતૃત્વની કળા, પુખ્તતા વગેરે પરિબળો ધ્યાને લેવાં જોઈએ, જેના પરિણામે કર્મચારીઓનો ઉત્સાહ વધે છે અને ધ્યેયસિદ્ધિ સરળ બને છે.

(3) શિસ્ત અંગેનો સિદ્ધાંત : સાધનોના ઈધ્રતમ ઉપયોગ અને પ્રવૃત્તિઓના સાતત્ય માટે ઔદ્યોગિક શિસ્ત હોવી ખૂબ જ જરૂરી છે. શિસ્ત એ એક ચોક્કસ પ્રકારનું સંવાદિતાભર્યું વાતાવરણ ઊભું કરે છે. ઔદ્યોગિક શિસ્ત એ ચોક્કસ પ્રકારના નિયમો અને આચારસંહિતાને કારણે સ્થપાય છે અને તેને કારણે એકમમાં અનુશાસન સ્થપાય છે; જ્યારે કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય ત્યારે શિસ્ત અને આચારસંહિતા મારફતે અંકુશ સરળ બને છે. કર્મચારીનો કાર્ય પ્રત્યેનો આનંદ વધે છે. સંચાલકો પણ સરળતાથી કામ લઈ શકે છે. શિસ્ત માટે દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષણ, કામદારો અને માલિકો વચ્ચે સ્પષ્ટ-ન્યાયી કરારો તેમજ શિક્ષાનો ન્યાયી અમલ જેવી બાબતો મહત્વની છે.

(4) હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત : કર્મચારી એક કરતાં વધુ ઉપરી અધિકારીઓના હુકમોનું એક સાથે પાલન કરી શકે નાથી, તેથી આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ પણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ. તેનો અર્થ એમ પણ થાય કે કોઈ એક કાર્ય માટે કે વિભાગ માટે કર્મચારીઓ એક જ અધિકારીને જવાબદાર હોવા જોઈએ. હુકમની એક વાક્યતાના સિદ્ધાંતને કારણે કર્મચારીઓમાં હુકમને લગતી કોઈપણ મૂંજવણ ઊભી થતી નથી. એક કરતાં વધુ અધિકારીઓ દ્વારા હુકમો આપવામાં આવે તો કર્મચારીઓમાં મૂંજવણ ઊભી થાય છે અને તેને કારણે ઔદ્યોગિક શિસ્ત જળવાતી નથી.

(5) દોરવણીની એકવાક્યતાનો સિદ્ધાંત : આયોજન એ ભવિષ્ય માટેની રૂપરેખા છે. જે કાર્ય વિભાજન અને વિશિષ્ટીકરણના આધારે પાર પાડી શકાય છે. આયોજનના અમલ દરમિયાન જો વિચલનો જણાય તો દોરવણી-માર્ગદર્શન અપાય છે. આ દોરવણી કોઈ ચોક્કસ ઉપરી અધિકારી દ્વારા આપવી જોઈએ. આમ કરવાથી એક સમાન

કાર્યો અને પ્રયત્નોનું સંકલન સરળતાથી થઈ શકે છે. આ સિદ્ધાંત મુજબ કર્મચારી જૂથની ઉપર એક જ અધિકારી હોવો જોઈએ અને આ જૂથ એક જ ધ્યેયની સિદ્ધિ માટે જૂથ કાર્ય કરતું હોવું જોઈએ.

(6) સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન : સંચાલન એ સામૂહિક પ્રવૃત્તિ છે. તેથી વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે વિભાગ-વિભાગ વચ્ચે સંકલન હોવું જરૂરી બને છે તેથી ધંધાકીય એકમની ધ્યેય સિદ્ધિ સરળ બને છે. આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ વ્યક્તિગત કે કર્મચારી જૂથના હિતને સમગ્ર એકમના હિતની સામે ગૌણ ગણવું જોઈએ, એટલે કે વ્યક્તિગત હિત કરતાં સામાન્ય હિતને પ્રાધાન્ય આપવું જોઈએ.

(7) કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત : કર્મચારીઓ જે સેવા આપે છે તેના બદલામાં તેમને જે વળતર મળે છે તેને વેતન કહે છે. આ સિદ્ધાંત મુજબ પેઢીના કર્મચારીઓને ચૂકવવામાં આવતું વેતન ન્યાયી હોવું જોઈએ. નિયમ અનુસાર વેતનની ચૂકવણી એ માલિક અને કર્મચારીઓ વચ્ચેનો સંબંધ સુદૃઢ બનાવે છે. એકમમાં બધા જ કર્મચારીઓ એકસરખી કાર્યક્ષમતાથી કાર્ય કરતા હોતા નથી. એકમમાં કેટલાક કાર્યક્ષમ કર્મચારીઓ પણ હોય છે, જેઓ નિશ્ચિત કરતાં વધારે ઉત્પાદન અને કામ આપે છે. તેઓને તેમની કાર્યક્ષમતાનો બદલો મળવો જરૂરી છે. આમ કરવાથી મજૂર ફેરબદલી દર ઘટે છે. કુશળ કારીગરો માટે બોનસ, નફાભાગ, સંચાલક મંડળમાં પ્રતિનિધિત્વ વગેરે જેવી પ્રોત્સાહક યોજના પણ અમલમાં મૂકાવી જોઈએ.

(8) કેન્દ્રીકરણનો સિદ્ધાંત : વ્યવસ્થાતંત્રના માળખાને સફળ બનાવવા માટે કેટલા અંશે સત્તાનું કેન્દ્રીકરણ કે વિકેન્દ્રીકરણ થવું જોઈએ તેની સ્પષ્ટતા હોવી જરૂરી છે. વ્યવસ્થાતંત્રમાં જેટલે અંશે સત્તાની સોંપણી થઈ નથી તેને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. કર્મચારીઓની શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે કેન્દ્રીકરણના સિદ્ધાંતને અપનાવવો જરૂરી છે. મોટા કદનાં એકમોમાં કેન્દ્રીકરણ ઓછું સફળ થાય છે, તેથી એકમના કદ મુજબ કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ કરવામાં આવતું હોય છે.

(9) સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત : આ સિદ્ધાંત સત્તાની ઉચ્ચ વહીવટી અધિકારીઓથી લઈ તળ સપાટીના કર્મચારીઓ સુધીની સાંકળ રચવા પર ભાર મૂકે છે. સત્તાની સાંકળ ઉચ્ચ સંચાલકોથી લઈ તળ સપાટી સુધી વણતૂટેલી રહેવી જોઈએ. દરેક સપાટીને અનુરૂપ સત્તા અને જવાબદારીની વહેંચણી થવી જોઈએ. એકમમાં કામ કરતા કર્મચારીને ઝ્યાલ હોવો જોઈએ કે તે કોને જવાબદાર છે અને તેને કોણ જવાબદાર છે. તેને લીધે એક રૈખિક સાંકળ ઉદ્ભાવે છે, જે ઉચ્ચ સપાટીથી નીચેની તરફ જાય છે અને તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ માહિતીપ્રેષણ થાય છે.

(10) વ્યવસ્થાનો સિદ્ધાંત : આ સિદ્ધાંત બે વસ્તુ પર ભાર મુકે છે. માલ-સામાન્યની વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા. માલ-સામાન્યની દરેક વસ્તુ તેના યોગ્ય સ્થાને હોવી જોઈએ. તેવી જ રીતે યોગ્ય લાયકાત, કૌશલ્ય ધરાવતા કર્મચારીને યોગ્ય સ્થાને મૂકવો જોઈએ. કોઈ ચોક્કસ સ્થાન માટે યોગ્ય કર્મચારીઓની ભરતી અંગેની પણ વ્યવસ્થા હોવી જોઈએ.

(11) સમાનતાનો સિદ્ધાંત : કર્મચારીઓ એ સંચાલન વ્યવસ્થાનો એક ભાગ છે. કર્મચારીઓ એ જીવંત વ્યક્તિ છે, તેથી તેમની પાસેથી કામ લેવા માટે વ્યવહારુ અભિગમ અપનાવવો પડે. અધિકારીઓએ કર્મચારીઓ પાસે કામ લેતી વખતે ન્યાયપૂર્ણ અને સમાનતાથી વર્તવું જોઈએ. આ માટે વૈધિક કે રૂઢિગત વલણની જગ્યાએ અવैધિક રૂપે વર્તન કરી એકમમાં સમાનતા સ્થાપવા માટે જરૂરી પ્રયત્નો કરવા જોઈએ. કર્મચારીઓનું સંચાલકો પ્રત્યેનું વર્તન એ વફાદારી, વલણ, સમાનતા અને ન્યાય પર આધારિત છે.

(12) સ્થિર કર્મચારીગણનો સિદ્ધાંત : કાયમી અને સ્થિર કર્મચારીગણ એ ધંધાકીય એકમની મૂડી છે. કોઈ એક એકમમાં લાંબો સમય ટકી રહેવાથી કર્મચારીનો વિકાસ થાય છે અને ધંધાકીય એકમને ધ્યેયસિદ્ધિ માટે કર્મચારીની સ્થિરતા ખૂબ જ મહત્વનો ફાળો આપે છે. લાંબા સમય સુધી કર્મચારી જે-તે એકમમાં રહેવાથી અધ્યયન વક્ફી અસરને પરિણામે ઉત્પાદકતા વધે છે તેમજ મજૂર ફેરબદલી દર ઘટે છે. કાયમી કર્મચારીઓ માટે બઢતી, તાવીમ વગેરેની વ્યવસ્થા કરવી જોઈએ.

(13) પહેલવૃત્તિનો સિદ્ધાંત : સંચાલકોમાં જેમ ઉદ્યોગસાહસિકતા જરૂરી છે તેમ કર્મચારીઓમાં પહેલવૃત્તિ હોવી જરૂરી છે. સંચાલકોએ એવું ધંધાકીય વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે જેમાં કર્મચારીઓની પહેલવૃત્તિને પ્રોત્સાહન મળે. પહેલવૃત્તિથી કર્મચારીઓમાં સ્વતંત્ર રીતે કાર્ય કરવાની શક્તિનો વિકાસ થાય છે, તેમની નેતૃત્વ શક્તિ પણ ભીલે છે.

(14) જૂથ ભાવનાનો સિદ્ધાંત : ધંધાકીય એકમની સફળતાનો આધાર સંચાલકો અને કર્મચારીઓના પરસ્પર સંબંધો પર રહેલો છે, તેથી બંને વર્ગમાં સંવાદિતાજ્ઞયા સંબંધો હોવા જોઈએ. સંચાલકોએ કર્મચારીઓ વચ્ચે જૂથ ભાવના પેદા કરવી જોઈએ. જો તમામ કર્મચારીઓ જૂથ બનીને કાર્ય કરશે તો એકમની ધ્યેયસિદ્ધિનું કાર્ય સરળ બને છે.

હેનરી ફેયોલે ઉપરના સિદ્ધાંતો દર્શાવતી વખતે કહ્યું હતું કે, ‘સંચાલનના સિદ્ધાંતોની ઉપર્યુક્ત યાદી એ અંતિમ યાદી નથી. સંચાલકો પોતાના અનુભવ, સંશોધન અને શાનને આધારે તેમાં નવા-નવા સિદ્ધાંતોનો ઉમેરો કરી શકે છે. આ સિદ્ધાંતોને ધંધાકીય, આર્થિક, રાજકીય અને સામાજિક એમ તમામ પ્રવૃત્તિઓમાં સરખી રીતે લાગુ પાડી શકાય છે.’

2.5 પીટર એફ. ડ્રકરનું સંચાલનક્ષેત્રે પ્રદાન (Contribution of Peter F. Drucker in the Field of Management)

પીટર એફ. ડ્રકર (1909-2005) ખૂબ જ પ્રાયાત સંચાલનશાસ્ત્રી તરીકે ધ્યાતપ્રાપ્ત લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. વૈશ્વિકરણને કારણે સમગ્ર વિશ્વની ધંધાકીય વ્યવસ્થાઓમાં પરિવર્તન આવ્યું હતું. જેને કારણે સંચાલનની નવી પદ્ધતિઓ વિકસાવવાની આવશ્યકતા ઊભી થઈ. પીટર એફ. ડ્રકરે માનવસંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્વ આપવા માટે ખાસ હિમાયત કરી. પીટર એફ. ડ્રકરના મુખ્ય પ્રદાનમાં ‘ધ્યેયલક્ષી સંચાલન’ અને ‘સ્વનિયમનનો સિદ્ધાંત’ મુખ્ય છે. ધ્યેયલક્ષી સંચાલન વિશે તેઓ જણાવે છે કે હેતુ સિદ્ધિ માટે કર્મચારીઓ અને સંચાલકોના ધ્યેયમાં એકસૂત્રતા હોવી જરૂરી છે. જુદાં-જુદાં ધંધાકીય સ્વરૂપનાં એકમો માટે ધ્યેયલક્ષી સંચાલન ખૂબ જ અસરકારક છે તેઓનું પ્રદાન માનવસંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન માટે મુખ્ય રહેલું છે. તેથી પીટર એફ. ડ્રકરને આધુનિક સંચાલનના પિતા કહેવામાં આવે છે.

આ પ્રકરણમાં તમે શું શીખ્યા ?

પ્રસ્તાવના : સંચાલનના સિદ્ધાંતો :

અર્થ : સામાન્ય અર્થમાં ધંધાકીય એકમમાં માનવ વર્તણુંકને સાનુદૂળ કરવા માટે અમૃત નિયમો, સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી ધ્યેયસિદ્ધિ સરળ બને. આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે.

ધ્યાલ : સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણુંક સાથે સીધો સંબંધ ધરાવે છે. તેથી જ સમયાંતરે તેમાં જરૂરી ફેરફારો કરી નવા સિદ્ધાંતોના ઉમેરાને અવકાશ રહે છે. સંચાલનના સિદ્ધાંતો એ નિર્ણય ઘડતર અને તેના અમલીકરણ માટેની વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા છે.

સ્વરૂપ : (1) સાર્વત્રિક (2) પરિવર્તનશીલ (3) સામાન્ય માર્ગદર્શિકા (4) માનવ વર્તણુંક પર આધારિત (5) આક્સિમેન્ટ્સ.

મહત્વ : (1) સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો (2) સંસાધનોનો ઈઝ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ (3) વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ (4) બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા (5) સામાજિક જવાબદારી અદા કરવા (6) સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી.

સંચાલન વિચારધારાઓ : સંચાલનની વિચારધારાઓ સમય-સમય પર રજૂ થયેલ વિશિષ્ટ દસ્તિબંદુની રજૂઆત છે. આ વિચારધારાઓમાં અનેક સંચાલન શાસ્ત્રીઓએ અલગ-અલગ મત આપી જુદા-જુદા સિદ્ધાંતો આપ્યા છે, જેને સંચાલનની વિચારધારાઓ કહેવામાં આવે છે.

પ્રશિષ્ટ વિચારધારાઓ : સંચાલનની જે વિચારધારાઓ 19મી સદીના અંત સુધીમાં રજૂ થઈ તેને પ્રશિષ્ટ વિચારધારાઓ કહેવામાં આવે છે. આ વિચારધારામાં ફેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો દ્વારા અને હેનરી ફેયોલે સંચાલનના સિદ્ધાંતો દ્વારા પોતાનું પ્રદાન આપ્યું.

નવપ્રશિષ્ટ વિચારધારાઓ : વીસમી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોએ હોર્થોન પ્રયોગો દ્વારા આ વિચારધારાને જન્મ આપ્યો. નવપ્રશિષ્ટ વિચારધારા સંચાલન અંગે વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂકે છે.

વર્તન સંબંધિત વિચારધારા : વર્તન સંબંધિત વિચારધારા મનોવૈજ્ઞાનિક તારણોના ઉપયોગ દ્વારા કર્મચારીના કાર્યસંતોષ અને કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકે છે. વર્તન સંબંધિત વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, ઔદ્ઘોગિક જગડાના નિકાલ, માહિતીસંચાર પ્રક્રિયા વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે.

આધુનિક વિચારધારાઓ : સંચાલન એ માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહેતાં સંચાલકોનો વિશિષ્ટ વ્યાવસાયિક વર્ગ આ દરમિયાન ઊભો થયો, જેમાં સંચાલનની સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કમ્પ્યુટર-ઈન્જેનિરિંગ ટેકનોલોજીના ઉપયોગની હિમાયત કરવામાં આવી છે. ફેડરીક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત :

અર્થ : વૈજ્ઞાનિક સંચાલન કોઈ પણ ખાસ એકમમાં કે કારખાનામાં કર્મચારીઓના પક્ષે સંપૂર્ણ માનસિક કાંતિ છે. તેઓની તેમનાં કાર્ય, ફરજો, સહકાર્યકર્તાઓ અને માલિકો પ્રત્યેની સંપૂર્ણ માનસિક કાંતિ છે.

વ્યાખ્યા : ફેડરીક ટેલરના જણાવ્યા મુજબ, ‘તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે તથા ઓછામાં ઓછા ખર્ચ કરે તે જોવું એટલે વૈજ્ઞાનિક સંચાલન.’

વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો : (1) વૈજ્ઞાનિક પદ્ધતિ (2) આયોજન અને અમલીકરણ (3) કાર્ય વિશ્લેષણ (4) પ્રમાણીકરણ (5) વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ (6) નાણાકીય ઉત્તેજન (7) કરકસર (8) માનસિક કાંતિ.

વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ :

સમય નિરીક્ષણ : કોઈપણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય-નિરીક્ષણ.

ગતિ નિરીક્ષણ : બિન જરૂરી, ખોટી દિશામાં થતા, બિનકાર્યક્ષમ હુલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ એટલે ગતિ નિરીક્ષણ.

બિન વેતનદરની પદ્ધતિ : કામદારોને તેમના કામના સમયને આધારે વેતન સંબંધિત ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે બિન વેતનદરની પદ્ધતિ.

હેનરી ફેડરીકના સંચાલનના સિદ્ધાંતો : (1) શ્રમ વિભાજનનો સિદ્ધાંત (2) સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, (3) શિસ્ત અંગેનો સિદ્ધાંત (4) હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત, (5) દોરવણીની એકવાક્યતાનો સિદ્ધાંત (6) સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌડા સ્થાન (7) કર્મચારી વેતનનો સિદ્ધાંત (8) કેન્દ્રીકરણનો સિદ્ધાંત (9) રૈબિક સાંકળનો સિદ્ધાંત (10) વ્યવસ્થાનો સિદ્ધાંત (11) સમાનતાનો સિદ્ધાંત (12) સ્થિર કર્મચારીગણનો સિદ્ધાંત (13) પહેલવૃત્તિનો સિદ્ધાંત (14) જૂથ ભાવનાનો સિદ્ધાંત.

પીટર એફ. ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન :

પીટર એફ. ડ્રકરનું માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તનાવ સંચાલન માટે મુખ્ય રહેલું છે. તેથી પીટર એફ. ડ્રકરને આધુનિક સંચાલનના પિતા કહેવામાં આવે છે.

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો :

- (1) સંચાલનના સિદ્ધાંતો એટલે શું ?

(A) અનુભવનો નીચોડ છે.	(B) સંચાલકો નક્કી કરે છે.
(C) પ્રયોગોથી નક્કી થાય છે.	(D) મેનેજરો નક્કી કરે છે.
- (2) નીચેનામાંથી ક્યા પરિબળમાં ફેરફારને કારણે સંચાલનના સિદ્ધાંતોમાં બદલાવ લાવવાની જરૂરિયાત ઊભી થાય છે ?

(A) મિલકતોમાં ફેરફાર	(B) મૂડીમાં ફેરફાર	(C) ટેક્નોલોજીમાં ફેરફાર	(D) સંચાલકોમાં ફેરફાર
----------------------	--------------------	--------------------------	-----------------------
- (3) વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા કોણ છે ?

(A) વ્યુથર જ્યુલિક	(B) ફેડરીક ટેલર	(C) હેનરી ફેડરીક	(D) પીટર એફ. ડ્રકર
--------------------	-----------------	------------------	--------------------
- (4) 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારાઓ કહે છે ?

(A) નવપ્રશિષ્ટ	(B) પૂર્વપ્રશિષ્ટ	(C) પ્રશિષ્ટ	(D) આધુનિક
----------------	-------------------	--------------	------------

- (5) નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા ?
 (A) હર્જબર્ગ (B) હેનરી ફેયોલ (C) ફેડરીક ટેલર (D) એલ્ટન મેયો

(6) 'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાડીનું તમારું બધું જ સાચવી લેશો.' - આ વિધાન કોણે કહ્યું હતું ?
 (A) એફ. ડબ્લ્યુ. ટેલરે (B) પ્રો. ઉર્વિકે (C) આર્ગરિસે (D) પીટર એફ. રૂકર

(7) નીચેનામાંથી ક્યા સંચાલનશાસ્ત્રીનું પ્રદાન આધુનિક વિચારધારામાં રહેલું છે ?
 (A) સી. કે. પ્રહલાદ (B) એલ્ટન મેયો (C) મેક્સ વેબર (D) હેનરી ગેન્ટ

(8) સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર કોણ હતા ?
 (A) ફેડરીક ટેલર (B) પીટર એફ. રૂકર (C) હેનરી ફેયોલ (D) ચેસ્ટર બન્ડાડ

(9) કોઈ પણ કાર્યમાંથી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનયલનમાંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું ?
 (A) સમય નિરીક્ષણ (B) ગતિ નિરીક્ષણ (C) ભિન્ન વેતન દર (D) કર્મચારી નિરીક્ષણ

(10) ઘેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા ?
 (A) પીટર એફ. રૂકર (B) ફેડરીક ટેલર (C) હેનરી ફેયોલ (D) મેક્સ વેબર

(11) શ્રમ વિભાજનના અમલ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ શક્ય બને છે ?
 (A) એકત્રીકરણ (B) વિશિષ્ટીકરણ (C) સરળીકરણ (D) સંકલન

(12) જો કર્મચારીને તેમની કાર્યક્ષમતાનો યોગ્ય બદલો ન મળે તો શેમાં વધારો થાય છે ?
 (A) મજૂર ફેરબદ્ધી (B) મજૂર બઢતી (C) મજૂર ગેરહાજરી (D) મજૂર અપકર્ષ

2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો :

- (1) સંચાલનના સિદ્ધાંતો એટલે શું ?
 - (2) સમય નિરીક્ષણ એટલે શું ?
 - (3) હુકમની એકવાક્યતા એટલે શું ?
 - (4) સંચાલન વિચારધારાઓ એટલે શું ?
 - (5) વર્તન સંબંધિત વિચારધારામાં કયા-કયા ઘ્યાતોનો સમાવેશ થાય છે ?
 - (6) આધુનિક વિચારધારામાં સંચાલનને અન્ય કયા વિષયો સાથે અનુબંધ છે ?

3. નીચેના પ્રશ્નોના ટંકમાં જવાબ લખો :

- (1) વૈજ્ઞાનિક સંચાલન એટલે શું ?
 - (2) સમાનતાનો સિદ્ધાંત શું સૂચવે છે ?
 - (3) ‘સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે.’ - સમજાવો.
 - (4) હેનરી ફ્રોલે ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિઓને કયા છ ભાગમાં વહેંચી છે ?
 - (5) ‘Rule of Thumb’ કોને કહે છે ?
 - (6) હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત જણાવો.
 - (7) ટેલરની બિન્ન વેતન દરની પદ્ધતી વિશે સમજાવો.

4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો :

- (1) સંચાલનના સિદ્ધાંતોના મહત્વ અંગે ચર્ચા કરો.
(2) આધુનિક વિચારધારાઓ વિશે ટૂંક નોંધ લખો.
(3) ‘સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તણું પર આધારિત છે.’ - વિધાન સમજાવો.
(4) વર્તન સંબંધિત વિચારધારાઓ વિશે સમજાવો.
(5) પીટર એફ. રૂકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન જણાવો.

5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ લખો :

- (1) वैज्ञानिक संचालनना सिद्धांतो समજावो.
(2) प्रशिक्षण विचारधारा अंगे सविस्तार समજावो.
(3) हेनरी फेयोलना संचालनना सिद्धांतो समજावो.
(4) संचालननुस्खर सविस्तार समજावो.